

Exam Seat No: _____

Enrollment No: _____

C.U.SHAH UNIVERSITY

Wadhwani City

Summer Examination-2014

Date: 3/06/2014

Subject Code : 5MC01CMA1

Subject Name:- Cost & Management Accounting

Branch/Semester:- M.Com(Guj) /I

Examination: Remedial

Time: 10:30 To 1:00

Instructions:-

- (1) Attempt all Questions of both sections in same answer book / Supplementary
- (2) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
- (3) Instructions written on main answer Book are strictly to be obeyed.
- (4) Draw neat diagrams & figures (If necessary) at right places
- (5) Assume suitable & Perfect data if needed

વિભાગ-૧

પ્રશ્ન-૧

- (અ) સંચાલકીય માહીતીતંત્રની વ્યાખ્યા આપો. (૦૩)
- (બ) સંચાલન અહેવાલ પેણણ નો અર્થ આપો. (૦૨)
- (ક) શુન્ય આધારીત અંદાજપત્ર નો અર્થ સમજાવો. (૦૨)

પ્રશ્ન-૨

- (અ) સંચાલકીય માહીતીતંત્રને અસર કરતા પરીબળો સમજાવો. (૦૫)
- (બ) આર્દ્ધ અહેવાલના સિદ્ધાંતો સમજાવો. (૦૫)
- (ક) શુન્ય આધારીત અંદાજપત્ર અને પ્રણાલીકાગત અંદાજપત્રનો તફાવત સ્પષ્ટ કરો (૦૪)
- અથવા
- (અ) શુન્ય આધારીત અંદાજપત્રની કાર્યવાહી સમજાવો. (૦૫)
- (બ) સંચાલકીય માહીતીતંત્રની રૂચના માટેની પૂર્વ આવશ્યકતાઓ કઈ કઈ છે. (૦૫)
- (ક) સંચાલન અહેવાલ પેણણના હેતુઓ સમજાવો. (૦૪)

પ્રશ્ન-૩

- (અ) શુન્ય આધારીત અંદાજપત્રના ફાયદા અને ગેરફાયદા સમજાવો. (૦૭)
- (બ) સંયુક્ત ખર્ચની ફાળવણીની વિવિધ રીતો વર્ણવો. (૦૭)

અથવા

- (અ) સંયુક્ત પેદાશ અને આડપેદાશને પડતરના હીસાબોમાં કેવી રીતે નોંધવામાં આવે છે. (૦૭)
- (બ) સંચાલનની વિવિધ સપાટીએ રજુ કરવાના અહેવાલના પ્રકારો સમજાવો. (૦૭)



પ્રોશ્ન-૪

- | | |
|--|------|
| (અ) સમતુટ બીજુ એટલે શું ? | (૦૩) |
| (બ) ABC પદ્ધતિ એટલે શું ? | (૦૨) |
| (ક) પડતર ચાલકો અને પડતર સમુહો એટલે શું ? | (૦૨) |

પ્રોશ્ન-૫

- | | |
|---|------|
| (અ) આંતર પ્રકીયા નફો સમજાવી આખર સ્ટોકમાં નહીં મળેલ નફાની ગણાતરી કેવી રીતે કરશો. | (૦૫) |
| (બ) નીચેની માહીતી પરથી ગણો | (૦૫) |

એકમ દીઠ વેચાણ કિંમત	૧૦
વેપારી વટાવ	૫%
એકમ દીઠ માલસામાન	૩
એકમ દીઠ મજુરી	૨
સ્થિર ખર્ચ	૧૦,૦૦૦
ચલીત ખર્ચ મજુરીના ૧૦૦ %	

જો વેચાણ સમતુટ જથ્થા કરતા ૧૦ % અને ૧૫% વધુ હોય તો ચોમાં નફો કેટલો ?

- | | |
|--|------|
| (ક) તફાવત આપો તફાવત પડતર અને સીમાંત પડતર | (૦૪) |
|--|------|

પ્રોશ્ન-૬

- | | |
|--|------|
| (અ) જવાબદારીલક્ષી હીસાબી પદ્ધતિની વ્યાખ્યા આપી તેના ફાયદા અને મર્યાદાઓ જણાવો. | (૦૫) |
| (બ) રમકડા બનાવતી એક કંપની હાલ ૮૦% ઉત્પાદન ક્ષમતાએ વાર્ષિક ૧૫૦૦૦ એકમો બનાવે છે કંપનીના રેકોર્ડ્ઝમાંથી નીચેની માહીતી મળે છે. | (૦૫) |

પિગત	૮૦%	૧૦૦ %
વેચાણ	૨૦,૦૦,૦૦૦	૨૫,૦૦,૦૦૦
ચલીત પરોક્ષ ખર્ચ	૨૨૫૦૦૦	૨૫૦૦૦૦
અધ્ય ચલીત પરોક્ષ ખર્ચ	૧૦૫૦૦૦	૧૧૧૦૦૦
સ્થિર ખર્ચ	૪૦૦૦૦૦	૪૭૦૦૦૦૦
ઉત્પાદન અને વેચાણ એકમો	૧૫૦૦૦	૧૮૭૫૦

વેચાણ પર નફાનો ગાળો ૧૦ % છે.

જો કંપની વધારાના ૩૭૫૦ એકમોનું ઉત્પાદન કરે તો નફાની પડતર દર્શાવતું પત્રક તૈયાર કરો.

- | | |
|--|------|
| (ક) પ્રવૃતી આધારીત પડતર પદ્ધતીના ફાયદા અને મર્યાદાઓ જણાવો. | (૦૪) |
|--|------|



પ્રશ્ન-૫

(અ) એક કંપની બે વસ્તુઓ અ અને બ બનાવે છે જેમાં એક્સરખાં સાધનો અને એક્સરખી પ્રક્રીયાઓનો ઉપયોગ થાય છે. એક વર્ષ દરમીયાન તેની ઉત્પાદનને લગતી માહીતી નીચે મુજબ છે.

(૦૭)

	અ	બ
ઉત્પાદન ના એકમો	૧૫૦૦૦	૨૧૦૦૦
એકમદીઠ પ્રત્યક્ષ કામદાર કલાકો	૩	૫
એકમદીઠ યંત્ર કલાકો	૯	૩
વર્ષ દરમીયાન કરેલ ગોઠવણીની સંખ્યા	૩૦	૧૨૦
વર્ષ દરમીયાન હાથ ઘરેલા ઓર્ડર	૪૫	૧૮૦

પરોક્ષ ખર્ચ નીચે મુજબ છે.

યંત્ર પ્રવૃત્તિ ને લગતા ૫,૫૦,૦૦૦

ઉત્પાદન ગોઠવણી ખર્ચ ૫૦,૦૦૦

ઓર્ડર હાથ ઘરવાને લગતા ખર્ચ ૧,૩૫,૦૦૦
૮,૫૫,૦૦૦

ઉત્પાદનના દરેક એકમ દીઠ પરોક્ષ ખર્ચની વસુલાતનો દર નીચે મુજબ ગણો.

(અ) પ્રણાલીકાગત પદ્ધતિ પ્રમાણે જેમાં પરોક્ષ ખર્ચની વસુલાત પ્રત્યક્ષ કામદાર કલાક દીઠ થાય છે.

(બ) પ્રવૃત્તિ આધારીત પદ્ધતિ ને આધારે

પ્રશ્ન-૬ (બ) નીચેની માહીતી પરથી ગણતરી કરો.

(૦૭)

સંપુર્ણ એકમો દર્શાવતું પત્રક

સંપુર્ણ ઉત્પાદનની એકમદીઠ પડતર દર્શાવતું પત્રક

મુલ્યાંકન પત્રક

પ્રકીયા ખાતુ

પ્રકીયામાં દાખલ કરેલ એકમો ૪૦૦૦ એકમદીઠ ૧.૮૭ લેખે સામાન્ય બગાડ દાખલ

કરેલ એકમોના ૫% આ પ્રકીયામાં એકમો પૂર્ણ થયા અને ત્યારપણીની પ્રકીયામાં

લઈ ગયા ૨૮૦૦ એકમો

હીસાબી સમયના અંતે પ્રકીયામાં અંદુરા એકમો ૮૦૦

પૂર્ણતાની કક્ષા

માલસામાન ૮૦%

મજુરી ૭૦%

શારોપરી ખર્ચ ૭૦%



બગાડ ની કિંમત (ભંગાર) Rs.1

કાચામાલની કિંમત ૭૪૮૦

મજુરી ખર્ચ ૧૦૬૮૦

શિરોપણી ખર્ચ ૭૧૨૦

અસામાન્ય બગાડનાં એકમો ૧૦૦ % પૂર્ણ છે.

અથવા

પ્રોઝેક્ટ-૫

(અ) એક ફેકટરીમાં ઉત્પાદન દરમીયાન અ.બ.ક નામની ત્રણ સંયુક્ત પેદાશો મળે છે. આ ત્રણેય અંગે સંયુક્ત ખર્ચ રૂ.૧૫,૨૦,૦૦૦ થયો છે.આ ત્રણેય અંગેની માઈટી નીચે મુજબ છે.

(૦૭)

પેદાશ	ઉત્પાદન એકમો	વેચાણ મુલ્ય એકમદીઠ (અલગ પ્રકીયા પણી)	અલગ પ્રકીયા ના કુલ ખર્ચ
અ	૫૦,૦૦૦	૫૦	૧૦,૦૦,૦૦૦
બ	૪૦,૦૦૦	૨૫	૨,૫૦,૦૦૦
ક	૫૦,૦૦૦	૪૦	૩,૫૦,૦૦૦

- (i) ઉપરની માઈટી પરથી અલગ ખર્ચાની પણી વેચાણ મુલ્યના પ્રમાણમાં સંયુક્ત ખર્ચની ફાળવણી કરો.
- (ii) અ.બ.ક ના એકમોને અનુક્રમે ૪ : ૪ : ૨ ભાર આપી ભારીત સરેરાશ પદ્ધતિ મુજબ સંયુક્ત ખર્ચની ફાળવણી કરો.
- (iii) ઉપરની બંને પદ્ધતીની પડતરના આધારે દરેક પેદાશનો કુલ નફો દર્શાવો.

પ્રોઝેક્ટ-૬ (બ) લક્ષ્યાંકિત પડતરની વ્યાખ્યા આપી તેના ફાયદા અને મર્યાદાઓ જણાવો.

(૦૭)

*****3***14***S

